

POLYCAB INDIA LIMITED

(formerly known as Polycab Wires Limited)

Polycab House, 771 Mogul Lane, Mahim (W), Mumbai – 400016

CIN: L31300GJ1996PLC114183

Tel : +91 22 2432 7070-74 Fax : +91 22 2432 7075

Email: shares@polycab.com Website: www.polycab.com



Date: 30th June 2020

To
Department of Corporate Services
BSE Limited
Phiroze Jeejeebhoy Towers, Dalal Street
Mumbai – 400 001

To
Listing Department
National Stock Exchange of India Limited
C-1, G-Block, Bandra-Kurla Complex
Bandra (E), Mumbai – 400 051

Scrip Code: 542652 Scrip Symbol: Polycab
ISIN:- INE455K01017

Dear Sir / Madam

Sub: Disclosure under Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015

With reference to the captioned subject, please find enclosed herewith the Newspaper clippings published in the Financial Express (English Language) in Ahmedabad edition and Gujarat Samachar (Gujarati Language) in Panchmahal edition of 30th June 2020, intimating the completion of dispatch of AGM Notice together with Annual Report for the financial year 2019-20, to all the Members and other persons so entitled to receive the said AGM Notice and Annual Report of the Company.

Kindly take the same on your record.

Thanking you

Yours Faithfully

For Polycab India Limited

Sai Subramaniam Narayana
Company Secretary and Compliance Officer
Membership No.: F5221
Address: Polycab House, 771, Mogul Lane
Mahim (West), Mumbai - 400 016



Registered Office:
Unit No.4, Plot No.105, Halol Vadodara Road,
Village Nurpura, Taluka Halol, Panchmahal, Gujarat-389350
Tel : 2676- 227600 / 227700

Companies use pandemic to look into shedding laggard brands

BLOOMBERG
London, June 29

'FROM BLACK TEA to bottled water, European companies are taking a hard look at underperforming businesses at a time when investors' profit expectations are already low because of the coronavirus pandemic.

With economies reeling and Covid-19 still spreading across swathes of the globe, top executives are hiring investment bankers or launching internal reviews to sort through portfolios and sell unwanted businesses.

"Investors are writing off 2020 completely but expect a tight, impeccable story for 2021 and 2022," said Adam Young, the global head of capital markets at advisory firm Rothschild.

"Those companies that don't have one need to look for it pretty quickly."

Private equity companies from KKR & Co. to Blackstone Group Inc. are lining up bids for Unilever Plc's tea unit, which could fetch more than 5 billion pounds (\$6.2 billion), people familiar with the matter told Bloomberg News last week.

The consumer-goods giant launched a strategic review of the unit in January, as the coronavirus was rampaging through China's Hubei province. At the time, CEO Alan Jope described the business, which includes well-known brands like Lipton and PG Tips, as "a structural drag on Unilever's growth."

In a similar vein, Nestle SA is considering a sale of its U.S. mass-market bottled water business, which includes the Poland Spring and Pure Life brands. The division globally had its worst performance in a decade last year and the North American unit, in particular, has seen competition from discount brands, as well as consumer resistance to plastic packaging.

While CEO Mark Schneider hasn't hesitated to shed underperforming businesses since he took over in 2017, the pandemic could force more boards to follow suit.

A SAFETY NET

A cash cliff spells trouble for US unemployed, and everyone else

JONNELLE MARTE & ANN SAPHIR
June 29

JUDITH RAMIREZ IS bracing for July.

That's when the hotel housekeeper and her electrician husband - who have both been out of work for three months - expect their combined unemployment benefits to drop by more than half, and their deferred \$1,500 monthly mortgage payment on their Honolulu home to come due.

It's a cash cliff millions of Americans face this summer as the emergency benefits - which lifted US consumer incomes by a record 10.8% in April - expire. The loss of that safety net looms in the weeks ahead, well before a sustained recovery is likely to take hold from the sudden and deep recession brought on by the novel coronavirus. Personal income dropped 4.2% in May, data Friday showed.

The \$600 supplement Congress added to weekly unemployment benefits is due to expire July 31.

Without new support, recipients face a substantial loss of income - particularly devastating for those like the Ramirez family who worked in hard-hit sectors like hospitality where new jobs are scarce. During high unemployment and a still-raging pandemic, the end of enhanced jobless benefits could drag on consumer spending, set off a wave of missed rent and mortgage payments and translate to a slower recovery, economists said. That's a great concern for Rachel Finchum, 55, who lost her job at a Nashville-based T-shirt printing company after 18 years. She has sought



Judith and Jose Ramirez with their daughters Mary Amber, 1, and Ashley, 5

forbearance on her mortgage but is worried about what will happen when the government programs run out. "I'm very scared to think I may not be able to make my bills," Finchum said. "With my future so uncertain, I have a house payment and bills based on 18 years of what I was making."

Benefits lifted spending

As the novel coronavirus pandemic exploded in March and local authorities shut down large parts of the US economy, the Trump administration and Congress softened the blow by moving quickly to roll out a patchwork of emergency aid. The centerpiece: stimulus checks for most households and more generous unemployment benefits for tens of millions of newly jobless Americans.

The combined cash aid provided \$3 in support for every \$1 in lost income in April, Oxford Economics' Gregory Daco estimated. And until it expires on July 31, the extra \$600 weekly unemployment payment on average makes up for income lost due to unemployment and reduced hours, he said.

Indeed about two-thirds people eligible for unemployment benefits can collect more in benefits than they earned while working, researchers from the University of Chicago found.

For low-wage workers like Ramirez, the help was particularly critical. Households across the board slashed spending as coronavirus-related restrictions began in March. But after the government began issuing stimulus checks, lower-income households resumed spending much faster than higher income households, with much of the cash going to basics like utilities and groceries, said Michael Stepler of Harvard University's Opportunity Insights.

Outlays by low-income households are now only about 3% below pre-crisis levels, versus minus 13% for high-income households.

When the extra benefits run out, jobless benefits will revert to their typical pre-pandemic levels, low by design to encourage people to look hard for work. In 15 states, the maximum unemployment benefit would replace less than half of the median earnings for a worker with a high school diploma, according to Kathryn Anne Edwards, a labor economist for the RAND Corporation.

That may pressure some people short on cash to risk their health to take a low-paying job at a restaurant or delivery company, which may expose them to the virus, said Julia Coronado, president of MacroPolicy Perspectives and a former Federal

Reserve economist. "That's a very terrible choice for our policymakers to be telling people they need to make," she said.

And with unemployment expected to stay high and businesses in some sectors unable to open, many won't be able to find even those jobs, she said.

The drop-off in support is also a problem for the economy as a whole, reducing GDP by 2.5% in the second half of 2020, estimated Jason Furman, a Harvard professor who ran the Council of Economic Advisors under President Barack Obama.

Congress may consider at least a partial extension of the benefits, but the uncertainty is making some families cautious about their spending, said Mark Zandi, chief economist for Moody's Analytics.

"Lower-income households are worried that the pandemic will re-intensify and disrupt their incomes further," said Zandi. "They are also unsure of how much - if any - more help is coming from Washington D.C."

Ramirez, 40, spent a month chasing down her unemployment benefits after she stopped working in late March. When the payments finally started arriving, Ramirez banked them to build a cushion.

Knowing that the benefits are going to be reduced dramatically and unsure of when they'll get back to work, Ramirez and her husband are living frugally. To save money on groceries, they wake up at 5 a.m. about once a week to get in line at a nearby food bank. —REUTERS

Samsung's billionaire heir scores public win in graft probe

SOHEE KIM
Seoul, June 29

SAMSUNG HEIR-APPARENT JAY Y. Lee scored a symbolic public victory Friday after a civilian review panel recommended against indicting the billionaire on charges of corruption.

The panel, convened after Lee's lawyers invoked the rarely used system in an effort to undermine prosecutors, voted in favor of halting an indictment, a spokesperson for the supreme prosecutors' office said by phone. While not legally binding, that judgment could prove difficult to contravene.

"We respect the decision made by the committee members," Lee's attorneys said in a statement.

"We are thankful that the panel gave an opportunity for Samsung and vice chairman Jay Y. Lee to overcome the current crisis by focusing on business activities."

In most legal systems of the developed world, public prosecutors get to decide which cases to pursue, with judges or juries acting as a check by determining the ultimate verdict. In South Korea, the approach is a little different.

The country has established an unusual process that allows suspects to call for an indepen-

dent panel of experts to review prosecutors' investigations.

The highest-stakes case since this novel system was established in 2018 was heard Friday when lawyers for the billionaire scion of Samsung Group tried to convince a panel his prosecution for alleged financial crimes would be unfair.

Attorneys for Lee, de facto leader of Samsung Electronics Co., squared off Friday against government prosecutors before 14 academics, legal experts and civil activists.

Lee, embroiled in an increasingly contentious dispute with Korean prosecutors over allegations of bribery and accounting manipulation, represents the biggest test so far of a civil committee system created to help check prosecutors' powers.

Friday's panel served as a barometer for how the public views the Samsung chief's culpability as well as a test of the legitimacy of prosecutors, whose leader in Korea is appointed by the president. —BLOOMBERG

Parshwanath Corporation Ltd.				
EXTRACT OF AUDITED FINANCIAL RESULTS FOR QUARTER-IV AND YEAR ENDED ON 31ST MARCH 2020				
Sr. No.	Particulars	(Rs. in Lakhs except EPS data)		
		Quarter Ended 31/03/2020 (Audited)	Year Ended 31/03/2020 (Audited)	Quarter Ended 31/03/2019 (Audited)
1	Total Income from Operations	23.35	97.35	13.34
2	Net Profit for the period (before tax and exceptional items)	20.37	77.80	1.64
3	Net Profit for the period before tax (after exceptional items)	19.77	87.70	3.65
4	Net Profit for the period after tax (after exceptional items)	16.60	73.35	2.87
5	Total Comprehensive Income for the period (Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax))	16.51	73.26	2.93
6	Equity Share Capital (Face Value of Rs.10/-each)	313.18	313.18	313.18
7	Reserve (excluding Revaluation Reserve)	-	688.03	-
8	Earnings Per Share (EPS) (of Rs. 10/- Each) (for continuing and discontinued operations) not annualised			
	(a) Basic	0.53	2.34	0.09
	(b) Diluted	0.53	2.34	0.09

Notes: - The above is an extract of the detailed format of Financial Results for the quarter and year ended on March 31, 2020 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosures Requirements) Regulations, 2015. The full format of the Financial Results are available on the website of the stock exchange, website: www.bseindia.com.

BY ORDER OF THE BOARD
RUSHABHAI N. PATEL
MANAGING DIRECTOR (DIN: 00047374)

THE INDIAN HOTELS COMPANY LIMITED

Corporate Identification No. (CIN) : L74999MH1902PLC000183
Registered Office : Mandlik House, Mandlik Road, Mumbai - 400 001
Tel.: 91 22 6639 5515 Fax No.: 91 22 2202 7442
E-mail: investorrelations@tajhotels.com Website: www.ihclata.com

PUBLIC NOTICE - 119th ANNUAL GENERAL MEETING OF THE INDIAN HOTELS COMPANY LTD

This is to inform that, in view of the outbreak of the COVID-19 pandemic, the Annual General Meeting ('AGM'/Meeting) of The Indian Hotels Company Limited (the 'Company') will be convened through Video Conference ('VC')/other audio visual means ('OAVM') in compliance with the applicable provisions of the Companies Act, 2013 and rules made thereunder, read with General Circular No. 14/2020 dated April 8, 2020, General Circular No. 17/2020 dated April 13, 2020, General Circular No. 20/2020 dated May 5, 2020 issued by the Ministry of Corporate Affairs ('MCA Circulars') and Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020 issued by the Securities and Exchange Board of India ('SEBI Circulars').

The 119th Annual General Meeting of the Members of The Indian Hotels Company Limited will be held on July 27, 2020 at 3.00 p.m. (IST) through VC/OAVM facility provided by National Securities Depositories Limited ('NSDL') to transact the businesses as set out in the Notice convening the AGM.

The e-copy of 119th Annual Report of the Company for the Financial Year 2019-20 (the 'Annual Report') along with the Notice of the AGM, Financial Statements and other Statutory Reports will be available on the website of the Company at <https://www.ihclata.com/investors/> and on the website of NSDL at www.evoting.nsdl.com. Additionally, the Notice of AGM along with the Annual Report will also be available on the websites of the stock exchanges on which the securities of the Company are listed, i.e. at www.nseindia.com and www.bseindia.com.

Members can attend and participate in the AGM ONLY through the VC/OAVM facility, the details of which will be provided by the Company in the Notice of the Meeting. Accordingly, please note that no provision has been made to attend and participate in the 119th AGM of the Company in person, to ensure compliance with the directives issued by the government authorities with respect to COVID-19. Members attending the meeting through VC/OAVM shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013.

The Notice of AGM along with the Annual Report for Financial Year 2019-20 will be sent electronically to those Members whose e-mail addresses are registered with the Company / Registrar & Share Transfer Agents ('Registrar') / Depository Participants ('DPs'). As per the SEBI Circular, no physical copies of the 119th AGM Notice and Annual Report will be sent to any Shareholder. Members who have not yet registered their email addresses are requested to follow the process mentioned below, before 5:00 p.m. (IST) on July 13, 2020, for registering their email addresses to receive the Notice of AGM and Annual Report electronically and to receive login ID and password for e-Voting.

Process to be followed for registration of e-mail address is as follows:

- Visit the link: https://linkintime.co.in/emailreg/email_register.html
- Select the company name viz. The Indian Hotels Company Limited;
- Enter the DP ID & Client ID / Physical Folio Number and PAN number. In the event the PAN details are not available on record for Physical Folio, Member to enter one of the Share Certificate numbers;
- Upload a self-attested copy of PAN card for authentication. If PAN details are not available in the system, the system will prompt the Member to upload a self-attested copy of the PAN card for update;
- Enter your e-mail address and mobile number;
- The system will then confirm the e-mail address for receiving this AGM Notice.

For permanent registration of their e-mail address, Members holding shares in demat form are requested to update the same with their Depository Participants ('DPs') and to the Registrar in case the Members are holding shares in physical form.

The Company is pleased to provide remote e-voting facility ('remote e-voting') of NSDL to all its Members to cast their votes on all resolutions set out in the Notice of the AGM. Additionally, the Company shall also provide the facility of voting through remote e-voting system during the Meeting. Detailed procedure for remote e-voting before the AGM / remote e-voting during the Meeting will be provided in the Notice of the AGM.

Members who have not updated their Bank account details for receiving the dividends directly in their bank accounts through Electronic Clearing Service or any other means, may follow the following instructions to do so latest by July 13, 2020:

Physical Holding	Demat Holding
1) Visit the link https://linkintime.co.in/emailreg/email_register.html under Bank detail Registration - fill in the following details relating to bank account in which the dividend is to be received: • Name of Bank; • Bank Account Number and • 11 digit IFSC Code; a) upload a self-attested scanned copy of the PAN Card; b) upload a self-attested scanned copy of any document (such as AADHAR Card, Passport) in support of the address of the Member as registered with the Company; c) upload a self-attested scanned copy of cancelled cheque leaf bearing the name of the Member or first holder, in case shares are held jointly.	Members holding shares in demat form are requested to update their Electronic Bank Mandate with their respective DPs.

In view of the outbreak of COVID-19, in case of non-availability of the bank details of any Member, the Company shall dispatch the dividend warrant/cheque by post to such Member, upon normalization of postal services and other activities.

Pursuant to the Finance Act, 2020, dividend income will be taxable in the hands of the Shareholders w.e.f. April 1, 2020 and the Company is required to deduct tax at source ('TDS') from dividend paid to the Members at prescribed rates in the Income Tax Act, 1961 (the 'IT Act'). In general, to enable compliance with TDS requirements, Members are requested to complete and / or update their Residential Status, PAN, Category as per the IT Act with their DPs or in case shares are held in physical form, with the Company / its Registrar by sending documents at its email ID ihcldivtd@linkintime.co.in or update the same by visiting the link : <https://linkintime.co.in/formsreg/submitof-form-15g-15h.html> on or before July 13, 2020. The detailed process of the same is available on the website of the Company at <https://www.ihclata.com/investors/>.

For The Indian Hotels Company Limited

sd/-
BEEJAL DESAI
Senior Vice President
Corporate Affairs and Company Secretary (Group)

Place : Mumbai
Date : June 29, 2020

Ahmedabad

OZONE WORLD LIMITED				
Audited Financial Results for the Quarter and Year ended on 31 st March, 2020				
Particulars	(Rs. in Lacs)			
	Quarter Ended 31-03-2020	Quarter Ended 31-03-2019	Year Ended 31-03-2020	Year Ended 31-03-2019
Total Income from operations	15.59	86.35	64.27	131.13
Net Profit / (Loss) from ordinary activities after tax	0.36	4.05	31.39	35.00
Total Comprehensive income for the period (Comprising profit for the period and Other Comprehensive Income for the period) after tax	0.36	4.05	31.39	35.00
Equity Share Capital	369.91	369.91	369.91	369.91
Earnings Per Share (of Rs. 10/- each)				
Basic	0.01	0.11	0.85	0.95
Diluted	0.01	0.11	0.85	0.95

Note : 1. The above is an extract of the detailed quarterly results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full result of the Quarterly Results is available on the stock exchange website (www.bseindia.com) and also available on the Company's website www.ozoneworld.in

FOR OZONE WORLD LIMITED
JAYESH KUMAR PATEL
MANAGING DIRECTOR (DIN : 00907313)

Place: Ahmedabad
Date: 29th June, 2020

By order of the Board
For SJ Corporation Limited
Deepak B Upadhyay
Managing Director (DIN:92270389)

Place : Mumbai
Date : June 29, 2020

DABUR INDIA LIMITED	
CIN - L24230DL1975PL007808 Registered Office: 31, Asaf Ali Road, New Delhi - 110 002 Tel. No. - 011-23234348, Fax No. - 011-23222051 Website - www.dabur.com; e-mail: investors@dabur.com	
NOTICE	
In compliance of Regulation 47(1)(a) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 this is to inform that a meeting of the Board of Directors of the Company will be held on Thursday, the 30th July, 2020 at New Delhi to, inter-alia, consider and approve the Unaudited Financial Results for the Quarter ending on 30th June, 2020.	
Investors may also refer to the websites: www.dabur.com , www.nseindia.com or www.bseindia.com	
for Dabur India Limited Sd/- (A.K Jain) E.V.P. (Finance) & Company Secretary	
New Delhi 30th June, 2020	

POLYCAB INDIA LIMITED	
(formerly known as Polycab Wires Limited) CIN: L31300GJ1996PLC141483 Registered Office: Unit 4, Plot No.105, Halol Vadodara Road, Village Nurpura, Taluka Halol, Panchmahal, Gujarat - 389350 Tel No: +91 2676 227600 / 227700 Website: www.plycab.com Email: shares@plycab.com	
NOTICE	

1. Notice is hereby given that the 24th Annual General Meeting ('AGM') of Polycab India Limited (the 'Company') is scheduled to be held on Tuesday, July 21, 2020 at 9.00 a.m. through video conferencing (VC) / Other Audio visual Means (OAVM) in compliance with General Circular Nos. 14/2020 dated April 8, 2020, 17/2020 dated April 13, 2020 and 20/2020 dated May 5, 2020 issued by the Ministry of Corporate Affairs and SEBI Circular dated May 12, 2020, to transact the Ordinary and Special businesses as set out in the Notice.

In compliance with the above circulars, electronic copies of the Notice of the AGM along with Annual Report for the Financial Year 2019-20 have already been emailed to all the shareholders whose email addresses are registered with the Depository Participants. The e-mailing of all Notices has been completed on Monday, June 29, 2020.

2. In terms of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 and relevant provisions of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company is pleased to provide its members with the remote e-voting facility to cast their vote electronically on the resolutions mentioned in the AGM Notice using the electronic voting platform provided by National Securities Depository Limited ('NSDL'). The facility of electronic voting shall also be made available during the meeting on the day of the AGM for those members who have not already casted their vote by remote e-voting. The Board has appointed Mr. Dilip Bharadia, Practising Company Secretary, as scrutinizer for conducting the voting process in a fair and transparent manner. The members may note the following:

- Members holding shares either in physical form or in dematerialized form, as on the cut-off date i.e. Tuesday, July 14, 2020 may cast their vote electronically on businesses as set out in Notice through this remote e-voting.
- Any person, who acquires shares and become a Member of the Company after sending the notice and holding shares as on the cut-off date i.e. Tuesday, July 14, 2020, may obtain the login id and password by sending an email to evoting@nsdl.co.in or shares@plycab.com by mentioning his/her Folio Number/DP ID and Client ID Number. However, if you are already registered with NSDL for e-voting then you can use your existing user ID and password for casting your vote.
- The remote e-voting period commences on Saturday, July 18, 2020 at 9.00 a.m. and ends on Monday, July 20, 2020 at 5.00 p.m. The remote e-voting module shall be disabled by NSDL for voting thereafter.
- The remote e-voting shall not be allowed beyond the said date and time.
- The facility for voting through electronic voting system shall also be made available at the AGM and the member participating in AGM through VC/OAVM, who have not already cast their vote by remote e-voting shall be able to exercise their right in the meeting.
- The member who have cast their vote by remote e-voting prior to the meeting may also attend the AGM through VC/OAVM, but shall not be entitled to cast their vote again in the meeting.
- Any person whose name is recorded in the register of members or in the register of beneficial owner maintained by the depository as on cut-off date only shall be entitled to avail the facility of remote e-voting or voting at the meeting.
- Member may note that the notice of the 24th Annual General Meeting and the Annual Report for F.Y. 2019-20 are also available on the Company's website (www.plycab.com), website of NSDL (www.evoting.nsdl.com) as well as on the website of BSE Ltd. and National Stock Exchange of India Limited; and can be made available for inspection by writing to the Company at shares@plycab.com.
- In case of any queries / grievances connected with e-voting, members may refer the Frequently Asked Questions ('FAQs') for shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on toll free no. 1800-222-990 or send a request at evoting@nsdl.co.in. Members may also contact the undersigned at shares@plycab.com.

For Polycab India Limited
(formerly known as Polycab Wires Limited)
Sd/-
Subramaniam Sai Narayana
Company Secretary & Compliance Officer
Membership No. F5221

Date: June 29, 2020
Place: Panchmahal, Gujarat

SJ CORPORATION LIMITED						
CIN : L51900GJ1981PLC103450						
Corp. Office: 201, Shyam Bungalow, 199/200, Puspaha Colony, Manchubhai Road, Malad (E), Mumbai - 97.						
Email ID : sjcorporation9@yahoo.com; Tel No/Fax No: 022-28449521; Website: www.sjcorp.in						
Extract of Standalone Audited Financial Results for the Quarter/Year Ended 31st March, 2020.						
Sr. No.	Particulars	Quarter Ended		Year Ended		
		31-03-2020	31-12-2019	31-03-2019	31-03-2020	31-03-2019
(Rs. in Lacs)						
1.	Total income from operations (net)	94.84	367.18	267.68	876.33	892.27
2.	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items)	(6.13)	8.79	(3.12)	1.11	25.52
3.	Net Profit/(Loss) for the period before Tax (after Exceptional items)	(6.13)	8.79	(3.12)	1.11	25.52
4.	Net Profit/(Loss) for the period after Tax (after Exceptional items)	(4.46)	7.19	(3.64)	1.47	21.06
5.	Total comprehensive income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	(7.63)	8.26	(15.85)	(14.09)	(6.88)
6.	Paid up Share Capital (FV of Rs. 1/- each fully paid up)	83.55	83.55	83.55	83.55	83.55
7.	Other Equity	-	-	751.30	765.39	-
8.	Earnings per equity share (for discontinued & continuing operations)					
	1. Basic	(0.05)	0.090	(0.04)	0.02	0.25
	2. Diluted	(0.05)	0.090	(0.04)	0.02	0.25
Segment Information for the Quarter/Year ended 31st March, 2020.						
Sr. No.	Particulars	Quarter Ended		Year Ended		
		31-03-2020	31-12-2019	31-03-2019	31-03-2020	31-03-2019
(Rs. in Lacs)						
1.	Segment Revenue (Sales/Income from each segment)					
	a) Polished diamonds & Jewellery	94.11	365.85	260.74	871.86	

